

ભાટ કન્વેન્શન સેન્ટર ખાતેથી ઝાડ, ઝાડી, ઝાંખરાં અને ઘાસ વગેરે મૂળમાંથી કાઢી આ લાકડું, ઝાડી, ઝાંખરાં વગેરે સ્થળ પરથી લઈ જવાના કામનું ભાવપત્રક

ભાવપત્રક

ક્રમ	વિગત	રકમ આંકડામાં	રકમ શબ્દોમાં
૧	ભાટ કન્વેન્શન સેન્ટર ખાતેથી ઝાડ, ઝાડી, ઝાંખરાં વગેરે મૂળમાંથી કાઢી આ લાકડું, ઝાડી, ઝાંખરાં, વગેરે સ્થળ પરથી લઈ જઈ જગ્યા યોખ્ખી કરી આપતાં અમને / મને જે વળતર મળે છે યોખ્ખી રકમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં જમા કરાવીશ જે રકમ બાજુમાં દર્શાવેલ છે.		

આ ભાવપત્રક અને તેની સાથેની શરતો અમે વાંચી સમજીને તેની ઉપર સહી કરેલ છે જે આ સાથે બીડેલ છે અને તે અનુસાર ઉપર જણાવેલ ભાવ ભરેલ છે.

ઠેકેદારની સહી અને સિક્કો

કાર્યપાલક ઈજનેર,
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ
જીઆઈડીસી, અમદાવાદ

ભાટ કન્વેન્શન સેન્ટર ખાતેથી ઝાડ, ઝાડી, ઝાંખરાં વગેરે મૂળમાંથી કાઢી આ લાકડું, ઝાડી, ઝાંખરાં વગેરે સ્થળ પરથી લઈ જવાના કામની શરતો

શરતો

- (૧) ઠેકેદારે બધાજ ઝાડ, ઝાડી ઝાંખરા વગેરે મૂળમાંથી ખોદી કાઢી બધા જ લાકડા, મૂળ, ઝાડી, ઝાંખરા વગેરે નિગમની જમીન બહાર, કોઈને અડચણ ન પડે તે રીતે એક માસમાં નિકાલ કરવાનો રહેશે. સદર હરાજ માટે ઝાડ, ઝાડી, ઝાંખરા તળીયાની કિંમત રૂ. ૧,૫૦,૦૦૦.૦૦/- (રૂપિયા એક લાખ પચાસ હજાર પુરા.) નક્કી કરવામાં આવેલ છે.
- (૨) ઝાડ કાપવા માટે જે તે ખાતાની જરૂરી મંજૂરી મેળવવાની જવાબદારી ઠેકેદારની રહેશે.
- (૩) જે ઠેકેદારે સૌથી વધારે ભાવ ભરેલ હશે તેને આ કામનો હુકમ આપવામાં આવશે. હુકમ જારી કરતાં પહેલાં રૂ. ૫૦૦૦/- નો ડીપોઝિટ તરીકે, રાષ્ટ્રીયકૃત બેંકનો કાર્યપાલક ઇજનેરશ્રી, જીઆઇડીસી, અમદાવાદના નામે ડીમાન્ડ ડ્રાફ્ટ ભરવાનો રહેશે. આ કામ હુકમની તારીખથી એક માસમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે. ડીપોઝિટની રકમ સંતોષકારક રીતે કામ પૂર્ણ કર્યા બાદ પરત કરવામાં આવશે.
 - (અ) બાનાની રકમ સિવાયના કોઈપણ ભાવપત્રક વિચારણામાં લેવામાં આવશે નહીં અને ભાવપત્રક રદબાતલ ગણાશે અને તે માટે અત્રેની કચેરીની કોઈ જવાબદારી રહેશે નહીં.
- (૪) આ હુકમ જારી કર્યા બાદ તે સિવાયના બીજા ઠેકેદારની બાનાની રકમ પરત કરવામાં આવશે.
- (૫) સીલ કર્યા વગરના, નિર્ધારિત તારીખ અને સમય બાદ મોડા મળેલ કવરો સ્વીકારવામાં આવશે નહિ.
- (૬) જેમણે બાનાની રકમ ભરેલ નહિ હોય તેમના ભાવપત્રકોના કવરો ખોલવામાં આવશે નહિ.
- (૭) અપસેટ રકમથી ઓછી રકમ હશે તો ભાવપત્રક રદ કરવામાં આવશે.
- (૮) કોઈ પણ કે બધા જ ભાવ પત્રકો રદ કરવાનો અબાધિત અધિકાર નિગમ હસ્તક રહેશે.
- (૯) કામ પૂર્ણ થયા બાદ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી નરોડા દ્વારા કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર જારી કરવામાં આવશે તે પછી અનામતની રકમ પરત કરવામાં આવશે.

- (૧૦) આ કામ અંગેની વિશેષ માહિતીની જરૂર હોય તો આ કચેરીના રજા સિવાયના દિવસોમાં કચેરી સમયે ૩-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધી અત્રેની કચેરી પાસેથી જોઈ સમજી જાણી લેવાના રહેશે.
- (૧૧) આવેલ ભાવમાં કોઈપણ ભાવ મંજૂર કરવાના કે નહીં, તેનો સંપૂર્ણ અધિકાર નિગમના સક્ષમ અધિકારીશ્રીએ અનામત રાખેલ છે.
- (૧૨) આ કામના કોઈપણ તકરાર કે વાંધા પ્રસંગે મુખ્ય ઈજનેરશ્રી અથવા તેમણે આ અંગે આપેલ સત્તાઓ ધરાવતા કોઈપણ અધિકારીશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને ભાવ ભરનારને બંધનકર્તા રહેશે.
- (૧૩) ઉપરોક્ત શરતો જેમને કબૂલ મંજૂર હોય તેમજ આ ટેન્ડર સૂચનાના અનુસંધાનમાં આપેલા ભાવપત્રકો આ ટેન્ડરની સૂચના/ શરતોને આધિન રહીને જ ભરાયેલા છે તેમ માનવામાં આવશે. આ અંગેના નિર્ણય સામે વાંધા કે તકરારને અવકાશ રહેશે નહીં. કોઈપણ શરતી ભાવો મંજૂર કરવામાં આવશે નહીં. કોઈપણ શરતોવાળું ટેન્ડર/ ભાવપત્રક રદબાતલ થશે.
- (૧૪) જે ઈજારદારના ભાવપત્રક/હરાજી મંજૂર થશે તે ઈજારદારે નિગમ સાથે "કરારનામા" ફોર્મમાં રૂ. ૧૦૦.૦૦ નો અધેસીવ સ્ટેમ્પ લગાડી એગ્રીમેન્ટ કરવાનું રહેશે.
- (૧૫) ઝાડી ઝાંખર કાપ્યા બાદ થયેલ ખાડાઓમા ફરીથી ઝાડ ઉભા ન થાય તે માટે જંગલ ખાતા દ્વારા સુચવ્યા મુજબ જરૂરી રસાયણ યુક્ત દવા/ડીઝલ/ડામર વગેરી છાંટી ખાડામાથી માટી પુરવામા રહેશે.

ઠેકેદારની સહી અને સિક્કો

કાર્યપાલક ઈજનેર,
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ
જીઆઈડીસી, અમદાવાદ

-:સોગંદનામું:-

આથી હું નીચે સહી કરનાર નામે શ્રી

મેસર્સ.....ના માલિક/ ભાગીદાર/
પ્રતિનિધિ સદર કામ બાબતની સર્વે શરતો મેં કાળજીપૂર્વક વાંચી છે, અને સમજૂપૂર્વક આ સાથેના પત્રકમાં ભરેલ/
દર્શાવેલ ભાવો મારી/ અમારી પેઢી/ કંપનીને તથા તેના ભાગીદારો/ માલિકોને કબૂલ મંજૂર અને સંપૂર્ણપણે
બંધનકર્તા રહેશે, જેની હું/ અમો ખાત્રી આપું છું / આપીએ છીએ.

હેકેદારની સહી અને સિક્કો

કાર્યપાલક ઈજનેર,
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ
જીઆઈડીસી, અમદાવાદ